



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૧૦/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૨૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૯ વ્યક્તિઓને ઝડપી, ૧૩૭ લીટર દેશી દારૂ, ૩૭૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૪૦ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૦૧ રિક્ષા અને ૦૧ અશોક લોડીંગ ગાડી કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૧૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૨,૯૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૨૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૪૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૧૨૨/૧૮

માધવપુરા : જયદિપસિંહ કાળુસિંહ ઝાલા (ઉ.વ.૨૪)(રહે.નવા ચાર માળીયા, મેસ બિલ્ડીંગની બાજુમાં શાહીબાગ) એ તા.૨૯/૧૦/૧૮ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૬/૧૮ ના કલાક ૧૧/૦૦ થી તા.૦૬/૦૭/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) મોબાઇલ ફોન નંબર ૮૦૯૮૫૭૯૪૪૯ નો ધારક ભંડારી નામનો માણસ તથા (૨) મોબાઇલ ફોન નંબર ૮૦૯૮૫૭૯૬૦૯ નો ધારક સિકંદર નામનો માણસ ભેગામળી 'OLX' એપ્લિકેશન પર પાંચ લાખ રૂપિયામાં એક મારૂતી એટીકા કાર વેચાણ માટે મુકેલ જે જયદિપસિંહ ને પસંદ આવતા આરોપી સાથે કાર ખરીદવા માટે મેસેજ કરતા આરોપીઓએ જયદિપસિંહને વિશ્વાસમાં લઈ "તમારે કાર જોવી હોય તો તે કાર એરપોર્ટ પર હોય જેનો પાર્કીંગ ચાર્જીસ અને કારનાં ખરીદીનાં ટોકન પેટે તેમજ બીજા ખર્ચા મળી કુલ રૂપિયા ૧,૧૫,૬૦૦/- પોતાના 'શર્મા એન્ટરપ્રાઇઝ કોટક મહિન્દ્રા બેન્કનાં એકાઉન્ટ નંબર- 6412204302માં જમા કરાવડાવી" આજદિન સુધી કાર કે રૂપિયા પરત નહી આપી જયદિપસિંહ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.એન.બારોટ ચલાવે છે.

ઘરફોડ ચોરી:-

સમાચાર યાદી નં.૨૧૨૩/૧૮

સોલા હાઇકોર્ટ : મહેંદ્રસિંહ ભરતસિંહ યુડાવત (રહે.સે-૪ વ્રજધામ ફ્લેટની પાસે ચાણક્યપુરી) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧૦/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૨૯/૧૦/૧૮ સવારના ૭/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૨૫,૫૦૦/- અને રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૫,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

નારણપુરા : ભરતભાઈ ભાઈચંદભાઈ પટેલ (રહે,નીધી એપાર્ટમેન્ટ પ્રગતીનગર ચાર રસ્તા, નારણપુરા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧૦/૧૮ ના ૯/૦૦ થી તા.૨૯/૧૦/૧૮ ના કલાક ૯/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૭૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.કે.રાહોડ ચલાવે છે.

વેજલપુર : કૃણાલભાઈ અરવિંદભાઈ રાણા (રહે.કિર્તીધામ કોમ્પલેક્ષ જલતરંગ બસ સ્ટેન્ડની સામે વેજલપુર) એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૧૦/૧૮ ના ૯/૩૦ થી સાંજના ૪/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીના લોકરમાંથી ચાંદીનો સિક્કો કિંમત રૂપિયા ૧,૦૦૦/- અને રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૧,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વિ.કે.બારૈયા ચલાવે છે.

સોનાની ચેઇન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૧૨૪/૧૮

પાલડી : નિર્મળાબહેન ગૌતમભાઈ (રહે, સુખીપુરા નવા શારદામંદીર, વસંતકુંજ ચાર રસ્તા પાસે) તા.૨૯/૧૦/૧૮ ના કલાક ૧૨/૧૫ વાગ્યાના સુમારે પાલડી નુતન નાગરીક બેંકના ખાંચા પાસે રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) એ નિર્મળાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ નિર્મળાબહેન એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એફ.એ.પારગી ચલાવે છે.

માધવપુરા : જગતભાઈ સુરેશભાઈ પાટીલ(ઉ.વ.૪૮)(રહે.સીદીકમીયાની ચાલી, લુણસાવાડ, દરીયાપુર) તા.૨૯/૧૦/૧૮ રાતના ૧૦/૨૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન નમસ્તે સર્કલ પાસે એડવાન્સ પ્લાઝા આગળ રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જગતભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જગતભાઈ એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એન.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૧૨૫/૧૮

સાબરમતી : રૂપસિંઘ કિશોરસિંઘ ચૌહાણ (રહે.પ્રજાપતી સોસાયટી ઘાટલોડીયા) એ તા.૨૯/૧૦/૧૮ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે પોતાનો ભાઈ ભરતસિંઘ કિશોરસિંઘ ચૌહાણ (ઉ.વ.૩૫) (રહે.સાગર એપાર્ટમેન્ટ બલોલનગર ચાર રસ્તા રાણીપ) તા.૨૪/૧૦/૧૮ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે સાબરમતી પંચશીલ હોસ્પિટલ સામે રોડ ક્રોસ કરતા હતા દરમ્યાન એક BRTS બસના ચાલકે પુરઝડપે અને બેદરકારી થી બસ ચલાવી લાવતા ટક્કર વાગતા ઇજાઓ થતા, સારવાર અર્થે ભરતસિંઘ ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૯/૧૦/૧૮ સાંજના ૪/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી શનાભાઈ ધુળાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.